

ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ



ઘોરણ-૧૦ પછીના ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ કાર્યક્રમ :

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧

ગુજરાત રાજ્યની આણંદ, જુનાગઢ, નવસારી તથા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ઘોરણ-૧૦માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે ચાલતા ડિપ્લોમા કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા ધરાવતા ઇચ્છુક ઉમેદવારો માટે વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ અરજીપત્રક ભરવા માટે વેબસાઇટ www.poly.gsauca.in માં ઓનલાઇન અરજી ફી રૂ. ૧૦૦/- તા. ૧૮/૦૮/૨૦૨૦ થી તા. ૩૧/૦૮/૨૦૨૦ દરમ્યાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અરજી ફી પેટે ભર્યા બાદ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે તેમજ પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઇન થશે.

પ્રવેશ અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી www.gsauca.in અથવા www.poly.gsauca.in અથવા www.sdau.edu.in ઉપરથી મેળવી શકાશે. સદર તારીખોમાં ફેરફારને અવકાશ હોઇ જે અંગેની અદ્યતન માહિતી ઉપરોક્ત વેબસાઇટ ઉપરથી મેળવી લેવાની રહેશે. જેની વાલી / વિદ્યાર્થીઓએ નોંધ લેવા વિનંતી.

ડિપ્લોમા સંલગ્ન અભ્યાસક્રમો			
૧	કૃષિ ડિપ્લોમા	૪	પશુપાલન ડિપ્લોમા
૨	કૃષિ ઇજનેરી ડિપ્લોમા	૫	બાગાયત ડિપ્લોમા
૩	ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રીશન ડિપ્લોમા	૬	એગ્રો પ્રોસેસીંગ ડિપ્લોમા

અગત્યની સૂચના :

- (૧) ડિપ્લોમા અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા ઓનલાઇન www.gsauca.in અથવા www.poly.gsauca.in અથવા www.sdau.edu.in વેબસાઇટ ઉપરથી જોઇ / ડાઉનલોડ કરી શકાશે. અરજી ફોર્મ ભરતા પહેલા ઉમેદવારે ઓનલાઇન માહિતિ પુસ્તિકાનો પુરેપુરો અભ્યાસ કરી ફોર્મ ભરવાનું રહેશે.
- (૨) ઉમેદવારે અરજી ફી રૂ. ૧૦૦/- ઓનલાઇન ભરવાની રહેશે.
- (૩) અરજી ફી ભર્યા બાદ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
- (૪) ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે.
- (૫) જો ૭-૧૨ અને ૮-અના દાખલા ઉપરથી ઉમેદવાર અને જમીનના માલિક જોડેનો સંબંધ સ્પષ્ટ ન થતો હોય તો, તે બે વચ્ચેનો સંબંધ દર્શાવતું પેઢીનામું તેમજ ઘોરણ-૧૦ની માર્કશીટમાં દર્શાવેલ અટક અને ૭/૧૨, ૮-અમાં દર્શાવેલ અટકમાં ફેરફાર હોય તો તે અંગેનું સોગંદનામું પણ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું રહેશે.
- (૬) દિવ્યાંગ ઉમેદવારોએ દિવ્યાંગતા અંગેનું સરકારી હોસ્પિટલના સક્ષમ અધિકારી / સિવિલ સર્જન અથવા સુપ્રિન્ટેન્ડેન્ટ)નું પ્રમાણપત્ર પણ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું રહેશે.
- (૭) ઉમેદવારે મોકરાઉન્ડ પછી એક જ વાર યોઇસ ફીર્વીંગ બદલી શકશે.
- (૮) ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ મેળવ્યા બાદ ઓનલાઇન ફી ભરવાની રહેશે.
- (૯) ઉમેદવારને ઓનલાઇન પ્રવેશ મળ્યા બાદ ઉમેદવારે આગળના રાઉન્ડમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો માત્ર ઓનલાઇન ફી જ ભરવાની રહેશે. ઉમેદવારે કોલેજ ખાતે હાજર રહેવાનું રહેતું નથી.

તા. ૧૭/૦૮/૨૦૨૦

કુલપતિ અને નોડલ અધિકારી (ડિપ્લોમા અભ્યાસક્રમો)

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી,

સરદારકૃષિનગર